

B.A. Semester - 2 (CBCS) Examination
March/April - 2024 (As Per Syllabus Year-2016)
ECONOMICS : P3 PRINCIPLES OF ECO-2 (ELECTIVE-1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	ઘટતા મળતરનો નિયમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો.	
પ્રશ્ન.૨	ભાડાનો આધુનિક સિધ્ધાંત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	પેઢી વિકાસના લાભોની ચર્ચા કરો.	
પ્રશ્ન.૩	સરેરાશખર્ચ અને સીમાંતખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	નફાનો ગતિશીલતાનો સિધ્ધાંત સમજાવો અને તેની ટીકાઓ જણાવો.	
પ્રશ્ન.૪	“નફો જોખમ વહોરવાનું નહિ પરંતુ અને અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	વહેંચણીનો સિમાંત ઉત્પાદકતાનો સિધ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો. (કોઇપણ બે)	(૧૪)
	1) સ્થિરખર્ચ અને અસ્થિરખર્ચ	3) આભાસી ભાડું
	2) ઉદ્યોગ વિકાસના લાભો	4) કાચા નફા અને શુદ્ધ નફા વચ્ચેનો તફાવત

ENGLISH VERSION

Que.1	Explain the law of diminishing returns.	(14)
	OR	
Que.1	Explain the concept of opportunity cost with the help of illustration.	
Que.2	Explain the modern theory of rent.	(14)
	OR	
Que.2	Discuss the advantages of expansions size of firm.	
Que.3	Clarify the interrelationships between average cost and marginal cost with the help by diagram.	(14)
	OR	
Que.3	Explain the dynamic theory of profit and criticize it.	
Que.4	“profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty” – discuss.	(14)
	OR	
Que.4	Explain the marginal productivity theory of distribution.	
Que.5	Write a short note. (any two)	(14)
	1) Fixed cost and variable cost	
	2) The advantages of expansion size of industry quasi – rent.	
	3) Quasi – rent	
	4) Difference between gross profit & net profit.	
